



RAN - 1901130702020001

RAN-1901130702020001

M.A. Economics (Sem. II) Examination April - 2025

Macro Economics - II

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

(૧)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

M.A. Economics (Sem. II)

Name of the Subject :

Macro Economics - II

Subject Code No.: **1901130702020001**

Seat No.:

<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

Student's Signature

(૨) જમણી બાજુ દર્શાવેલ અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

(૩) પ્રશ્નો ૨ થી ૫ માંથી કોઈપણ બે પ્રશ્નો લખવા.

પ્ર. ૧ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ૧૦

૧. કાયમી આવકનો ખ્યાલ સમજાવો.
૨. વ્યાપાર ચક્રના તબક્કા જણાવો.
૩. IS-LM મોડેલ કયા બે ચલો વચ્ચેનાં સંબંધને સમજાવે છે?
૪. કેઈન્સ વિરુદ્ધ નાણાવાદનાં બે મુદ્દા જણાવો.
૫. કીમત-યાદી ખર્ચ એટલે શું?

પ્ર. ૨ વપરાશ વિધેયના આજીવન ચક્ર વપરાશનો સિદ્ધાંતની સવિસ્તાર સમજાવો. ૧૩

અથવા

પ્ર. ૨ વ્યાપાર ચક્ર અંગેના સિક્કસનાં સિદ્ધાંતની ચર્ચા કરો. ૧૩

પ્ર. ૩ IS-LM 'રેખા મોડેલ એ વ્યાજ-દર નિર્ધારણ માટે એક નિશ્ચિત ઉકેલ પૂરો પાડી શકે છે' આ વિધાનની ચર્ચા કરો. ૧૩

અથવા

પ્ર. ૩ તાર્કિક અપેક્ષાના સિદ્ધાંતની ટીકાત્મક ચર્ચા કરો. ૧૩

RAN-1901130702020001]

[1]

[P.T.O.]

P0021

પ્ર. ૪	ટૂંકનોંધ લખો (કોઈપણ બે)	૧૪
૧.	કાયમી આવકનો સિદ્ધાંત	
૨.	કોબ વેબનો સિદ્ધાંત	
૩.	AD-AS મોડેલ	
૪.	અનુકુલનશીલ અપેક્ષાઓ	

ENGLISH VERSION

Q. 1.	Answer the following in brief :	10
1.	Explain the concept of permanent income.	
2.	Explain the stage of the business cycle.	
3.	The IS-LM model explains the relationship between which two variables?	
4.	State two points of Keynesianism against monetarists.	
5.	What is a menu cost?	
Q. 2.	Explain the life cycle theory of consumption function.	13
	OR	
	Discuss Hicks's theory of business cycle.	13
Q. 3.	"The IS-LM curve model can provide a definitive solution for interest rate determination" Discuss this statement.	13
	OR	
	Critically discuss the theory of rational expectations.	13
Q. 4.	Write short notes (Any Two)	14
1.	The principle of permanent income	
2.	The principle of the cobweb	
3.	AD - AS model	
4.	Adaptive expectations.	